



सत्यमेव जयते

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXII] THURSDAY, 30th SEPTEMBER, 2021/ASHVINA 08, 1943 [No. 69

Separate paging is given to each part of the supplement to the Central Gazette and Central section in order that it may be filed as a separate compilation

PART-II

EXTRAORDINARY

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

સામાન્ય ચૂંટણી-૨૦૨૧

જાહેરનામું

ક્રમાંક : મઉમશબ/ચૂંટણી-૨૦૨૧/૪૨૮/૨૦૨૧.-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૩(૨) વર્ગ-ખ ચૂંટાયેલા સભ્યોની જોગવાઈ અનુસાર તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ ના વિનિયમ-૫(૧) હેઠળ રચાયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતિ નિયમોના નિયમ-૨૯ હેઠળ થયેલ જોગવાઈ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.

ક્રમ	ખંડ	મતવિભાગની વિગત	ચૂંટાયેલા ઉમેદવારનું નામ અને સરનામું
૧	ખંડ (૧)	ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની રજિસ્ટર થયેલી શાળાઓના હેડમાસ્તરો (આચાર્યો)નો મતવિભાગ	પટેલ જયપ્રકાશ પુરુષોત્તમભાઈ ઉન્નતિ માધ્યમિક શાળા, હિરાપુર, તા.સંતરામપુર જિ. મહિસાગર
૨	ખંડ (૨)	રજિસ્ટર થયેલી ઉત્તર બુનિયાદી શાળાઓના હેડમાસ્તરો અને શિક્ષકોનો મતવિભાગ	રાવલ જસવંતકુમાર કાન્તીલાલ સંસ્કારધામ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બંધવડ, તા. રાધનપુર જિ.પાટણ
૩	ખંડ (૩)	ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની રજિસ્ટર થયેલી શાળાઓના શિક્ષકોનો મતવિભાગ	પટેલ હસમુખભાઈ દેવજીભાઈ શ્રી જેઠાભાઈ દેવજીભાઈ પટેલ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા
૪	ખંડ (૪)	માધ્યમિક શિક્ષક તાલીમ કોલેજો અને સ્નાતક બુનિયાદી તાલીમ કોલેજોના પ્રિન્સિપાલોનો મતવિભાગ	બારોટ નિદત્ત પ્રભુદાસ* આઈ.એલ.ટી.બી.એડ. કોલેજ, કાલાવડ રોડ, જિ. રાજકોટ

ક્રમ	ખંડ	મતવિભાગની વિગત	ચૂંટાયેલા ઉમેદવારનું નામ અને સરનામું
૫	ખંડ (૫)	રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીવર્ગ (સ્ટાફ)નો મતવિભાગ	પટેલ મુકેશકુમાર બાબુલાલ શારદા વિદ્યાલય, સરવા, તા. જિ. પાટણ
૬	ખંડ (૬)	રજિસ્ટર થયેલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારી વર્ગ (સ્ટાફ)નો મતવિભાગ	પટેલ મુકેશભાઈ જશવંતભાઈ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, ઘેલવાંટ જિ. છોટા ઉદેપુર
૭	ખંડ (૭)	સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો મતવિભાગ	ખટાણા વિજયભાઈ કાળુભાઈ સરકારી માધ્યમિક શાળા, કુંભારવાડા જિ. ભાવનગર
૮	ખંડ (૮)	મંડળી રજીસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૬૦ અને મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ રજિસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓનો મતવિભાગ	કોરાટ પ્રિયવદન જીવરાજભાઈ શ્રી સરસ્વતી ચેરીટેબલ ટ્રસ્ટ, કસ્તુરબા રોડ, જિ. રાજકોટ (ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર - ૪/૭૬૪/રાજકોટ)
૯	ખંડ (૯)	રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાઓ અને રજિસ્ટર થયેલી ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વાલીઓના એસોસિયેશનના પ્રમુખોનો મતવિભાગ	વ્યાસ ધીરેન ઉમિયાશંકર શ્રી એસ.ડી.વ્યાસ શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ, અમરાઈવાડી, જિ. અમદાવાદ

*SCA NO./૨૧૮૨૪/૨૦૨૧ ના ચુકાદાને આધિન પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

તારીખ : ૨૯-૦૯-૨૦૨૧

ડી. એસ. પટેલ
ચૂંટણી અધિકારી અને
સચિવ
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર.

